

Email: cs@torrentpower.com

June 04, 2024

To,

Corporate Relationship Department

BSE Limited

14th Floor, P. J. Towers, Dalal Street, Fort, Mumbai – 400 001

SCRIP CODE: 532779

To,

Listing Department,

National Stock Exchange of India Limited

"Exchange Plaza", C – 1, Block G

Bandra- Kurla Complex, Bandra (East),

Mumbai - 400 051

SYMBOL: TORNTPOWER

Dear Sir / Madam,

Subject: Newspaper Advertisement of Notice to Shareholders

Pursuant to Regulation 30 read with Para A of Part A of Schedule III and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of newspaper advertisement published today i.e. June 04, 2024 in "The Financial Express" English (All India Editions) and "The Financial Express" Gujarati (Ahmedabad Edition), intimating to the Shareholders in respect of Equity Shares of the Company liable to transfer to Demat Account of Investor Education and Protection Fund ("IEPF") Authority, on which Dividend amounts have remained unclaimed for seven consecutive years or more.

You are requested to take the same on record.

Thanking you.

Yours faithfully,

For Torrent Power Limited

Rahul Shah

Company Secretary & Compliance Officer

Encl: As above

FINANCIAL EXPRESS

TOTAL REMUNERATION AT ₹66.25 CRORE IN FY24

Parekh is second-highest paid CEO among IT peers

FE BUREAU Bengaluru, June 3

Infosys' Salil Parekh is the second-highest paid CEO amongst the domestic IT services companies with a total remuneration of ₹66.25 crore in FY24. He received a total remuneration of ₹56 crore in FY23, according to Infosys'FY24 annual report.

Parekh's salary is second only to former Wipro CEO Thierry Delaporte, who earned about ₹166 crore in FY24. Parekh's compensation had declined to ₹56 crore in FY23 from ₹71 crore in FY22.

The rise in Parekh's salary in FY24 was mainly due to the higher number of restricted stock units (RSUs) he exercised, the company detailed in the annual report. Infosys offers RSUs based on time or performance indicators like total shareholder returns and the company's operating metrics. In its 2015 plan, the stocks are vested largely based on time, and in the 2019 plan, the benefit is based on performance indicators, including total shareholder returns and the company's operating metrics.

Parekh's pay package includes ₹39.03 crore from RSUs, ₹7 crore base pay and ₹19.75 crore in variable pay, which is an increase from ₹12.62 crore in FY23. Meanwhile, Nandan M Nilekani, nonexecutive chairman of Infosys, voluntarily opted out from receiving any remuneration.

Looking at the broader industry, remuneration among Infosys' rivals varied. Delaporte's FY24 earnings include a **MONEY MAKERS** Salil Parekh had received annual remuneration of

₹56.4 cr in FY23



■ Next best paid after Parekh is HCLTech's **C Vijayakumar** with

₹28.4 cr ■TCS' K Krithivasan drew

the lowest among peers at ₹25.36 cr for FY24

severance package of ₹92.1 crore. His successor, Srinivas Pallia, is set to receive about ₹50 crore in FY25. The next best paid CEO in the IT industry is C Vijayakumar of HCL Technologies with ₹28.4 crore in FY23. Tata Consultancy Services' CEO and MD K Krithivasan drew the lowest among the large IT companies at ₹25.36 crore for FY24.

LTIMindtree paid CEO Debashis Chatterjee, who was appointed in November 2022 after the merger of L&T and Mindtree, ₹17.5 crore in FY23. Tech Mahindra's Mohit Joshi received an annual fixed compensation of ₹6.5 crore and an equal amount in annual variable pay.

Infy hiring drops by 76% in FY24

PADMINI DHRUVARAJ Bengaluru, June 3

INFOSYS HAS MARKEDLY reduced its intake of college graduates with just 11,900 hired in FY24, a significant 76% drop from over 50,000 freshers hired in FY23. "We recruited nearly 11,900 college graduates in the year and ended the year with over 317,000 employees," said Parekh.

This reduction is part of a broader industry trend where top Indian IT companies have collectively seen a reduction in workforce numbers amidst uncertain demand and other market dynamics.

In a first in at least 23 years, Infosys also saw a headcount reduction by 25,994 to 317,240 in FY24. Attrition also declined to 12.6% from 12.9% in FY23.

CFO Jayesh Sanghrajka had said in April that Infosys had changed its hiring model significantly."We no more hire all the freshers from campus. We hire less than half of them from campus and more than half of them off campus," he had said.

Recently, NITES, an IT employee union, had alleged that Infosys has been repeatedly delaying onboarding of over 2,000 campus recruits.

GenAI focus

Infosys remains committed to its workforce and technolog-





KEY NUMBERS

■ Just 11,900 freshers hired in FY24, from over 50,000 in FY23

■ In a first in at least 23 years, headcount fell by 25,994 to 317,240 in FY24

■ Attrition also declined to 12.6% from 12.9% in FY23

ical advancements, said Parekh. "Our attrition reduced to 12.6%. We trained over 250,000 employees on AI skills. Our focus on gender diversity continues with about 39% of our workforce consisting of women employees," Parekh highlighted in the annual report.

The company's leadership is also steering towards maximising the potentials of generative AI. Nilekani said, "We are into the second year of the generative AI revolution, and some clarity is beginning to emerge from the noise and babble of the last 18 months," Nilekani said.

Adani enters retail finance sector

Launches co-branded credit cards with ICICI Bank

FE BUREAU Mumbai, June 3

ADANI ONE AND ICICI Bank have partnered with Visa to launch co-branded credit cards with airport-linked benefits. With this venture, the Adani Group has entered the retail finance sector.

The credit card is available in two variants — Adani One ICICI Bank Signature Credit Card and Adani One ICICI Bank Platinum Credit Card. These cards offer up to 7% Adani reward points on spends across the Adani Group consumer ecosystem like Adani One app, where one can book flights, hotels, trains, buses and cab. The reward points are also



NEW VENTURE

■ Cards will be available in two variants — Adani One ICICI Bank Signature Credit Card and Adani One ICICI Bank Platinum Credit Card

■ Up to 7% Adani reward points on spending across Adani consumer ecosystem, such as Adani One app, Adani CNG pumps, Adani-managed airports, others

available on spends at Adanimanaged airports, Adani CNG pumps, Adani Electricity bills and Trainman, an online train

booking platform.

The cards also offer an array of benefits like free air tickets and airport privileges like pre-

mium lounge access, Pranaam Meet & Greet Service, porter, valet and premium car parking. Card users can also avail discounts on shopping at duty free outlets and on food and beverage spends at the airports, and benefits like free movie tickets and Adani reward points on groceries, utilities, and international spends.

"The Adani One ICICI Bank Credit Cards are a window to a seamless digital ecosystem. By leveraging the Adani One platform, which integrates physical B2C businesses into the digital world, users will experience unparalleled convenience and accessibility," Jeet Adani, director, Adani Group, said.

Betting on Bodhi to harness GenAI for better efficiency, says Publicis Sapient

PADMINI DHRUVARAJ Bengaluru, June 3

PUBLICIS SAPIENT IS betting on its machine learning platform — Bodhi — which harnesses the power of generative AI (GenAI) to enhance marketing strategies and improve operational efficiencies. Bodhi is tailored for industries like financial services, retail, and supply chain management.

The US-based digital business transformation company has been leveraging Bodhi to drive innovation and growth, particularly in its Indian offices. This platform serves as the core AI infrastructure for its parent company, Publicis Group, enhancing operational efficiencies and fostering innovation in areas like marketing and supply chain management.

SANJAY MENON, MD, PUBLICIS SAPIENT

ITHINK GCCs ARE BECOMING MORE OF A VALUE PLAY FROM A PURE KIND OF **COST PLAY**

Bodhi integrates multiple functionalities into a single platform, including machine learning operations (MLOps), which streamline the deployment and management of machine learning models. An examstrategy and is crucial for the ple of Bodhi's capabilities is a content conceptualisation suite designed to accelerate the transition from marketing briefs to full campaigns, drastically reducing the turnaround time and increasing creativity

through AI-driven insights. Sudhan Rangarajan, AI and data lead at Publicis Sapient, told *FE*: "We are building products based on GenAI and AI. We

have been developing Bodhi over the last four years, and it's now implemented for many of our clients globally. Bodhi serves as the core AI platform for our parent." Publicis Sapient's GCCs in India have

played a pivotal

role in its global

company's growth, MD Sanjay Menon said. He said, "So you start with

plain vanilla captives, then GICs, GCCs now. I think they are becoming more of a value play from a pure kind of cost play. Looking at my operating expense budget, I was thinking how do I makeit 10% cheaper, 20% cheaper or get more work in the same budget? And therefore, I looked at India as a place where my pure cost arbitrage happened."

leverages internal capabilities but also engages with startups and forms strategic partnerships to push the boundaries of what can be achieved with AI. These are crucial as they enable the integration of the latest technological advancements and maintain a competitive edge.

Publicis Sapient not only

Embassy REIT raises ₹1,200-cr debt to acquire business park

REIT has completed the acquisition of a 5 million sq ft business park in Chennai for ₹1,185 crore as part of its strategy to expand its office assets portfolio and grow business.

EMBASSY OFFICE PARKS

The acquisition was funded through a debt of ₹1,200 crore. In a filing on Monday, Embassy REIT informed that it has completed the acquisition of Embassy Splendid TechZone (ESTZ), a Grade-A business

park in Chennai. The business park has 1.4 million sq ft of completed buildings, besides under-construction area of 1.6 million sqft and 2 million sqft of future development poten-

PICICI PRUDENTIAL MUTUAL FUND

ICICI Prudential Asset Management Company Limited Corporate Identity Number: U99999DL1993PLC054135

Registered Office: 12th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001. Corporate Office: ONE BKC, A - Wing, 13th Floor, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051; Tel.: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100, Website: www.icicipruamc.com, Email id: enquiry@icicipruamc.com Central Service Office: 2nd Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express

Notice to the Investors/Unit holders of ICICI Prudential Constant Maturity Gilt Fund, ICICI Prudential Banking and PSU Debt Fund and ICICI Prudential ELSS Tax Saver Fund (the Schemes)

Highway, Goregaon (E), Mumbai - 400 063. Tel.: 022 2685 2000 Fax: 022 26868313

Notice is hereby given that ICICI Prudential Trust Limited, Trustee to ICICI Prudential Mutual Fund has approved the following distribution under Income Distribution cum capital withdrawal option (IDCW option) of the Schemes, subject to availability of distributable surplus on the record date i.e. on June 6, 2024*:

| Name of the Schemes/Plans | Quantum of IDCW (₹ per unit) (Face value of ₹ 10/- each) \$# | NAV as on May 31, 2024 (₹ Per unit) |
|----------------------------------|--|---|
| ICICI Prudential Constant Maturi | ty Gilt Fund | |
| Quarterly IDCW | 0.1593 | 11.0320 |
| Direct Plan – Quarterly IDCW | 0.1664 | 11.2802 |
| ICICI Prudential Banking and PS | U Debt Fund | |
| Quarterly IDCW | 0.1503 | 10.8290 |
| Direct Plan – Quarterly IDCW | 0.1838 | 12.7785 |
| ICICI Prudential ELSS Tax Saver | Fund | |
| IDCW | 0.70 | 23.95 |
| Direct Plan - IDCW | 0.70 | 43.66 |

- The distribution will be subject to the availability of distributable surplus and may be lower depending upon the extent of distributable surplus available on the record date under the IDCW option of the Schemes.
- # Subject to deduction of applicable statutory levy, if any
- or the immediately following Business Day, if that day is a Non Business Day.

The distribution with respect to IDCW will be done to all the unit holders/beneficial owners whose names appear in the register of unit holders/Statement of beneficial owners maintained by the Depositories, as applicable under the IDCW option of the Schemes, at the close of business hours on the record date.

It should be noted that pursuant to payment of IDCW, the NAV of the IDCW option of the Schemes would fall to the extent of payout and statutory levy (if applicable).

For ICICI Prudential Asset Management Company Limited

Authorised Signatory

Date: June 3, 2024 No. 001/06/2024

Place: Mumbai

To know more, call 1800 222 999/1800 200 6666 or visit www.icicipruamc.com

Investors are requested to periodically review and update their KYC details along with their mobile number and email id.

To increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness Programs across the country. To know more about it, please visit https://www.icicipruamc.com or visit AMFI's website https://www.amfiindia.com

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



torrent

Regd. Office: "Samanvay", 600, Tapovan, Ambawadi, Ahmedabad - 380 015 (Gujarat), India Phone: +91-79-2662 8300 E-mail: cs@torrentpower.com

TORRENT POWER LIMITED

NOTICE

FOR THE ATTENTION AND IMMEDIATE ACTION OF THE EOUITY SHAREHOLDERS OF THE COMPANY)

Notice is hereby given that pursuant to the provisions of Section 124 (6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time ("Rules"), Equity Shares of the Company in respect of which dividend amounts have remained unclaimed for seven consecutive years or more are required to be transferred to the Demat account of Investor Education and Protection Fund ("IEPF") Authority.

The Company has sent individual communication to the concerned Shareholders whose shares are liable to be transferred to IEPF Authority as per the aforesaid Rules for taking appropriate action. The Company has uploaded full details of the concerned Shareholders on its website i.e., www.torrentpower.com.

The concerned Shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to Demat account of IEPF Authority, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them. The original share certificate registered in their name, will stand automatically cancelled and be deemed non-negotiable and upon such issue of new share certificate, the Company shall inform the depository by way of corporate action to convert the new share certificate into Demat form for the purpose of transfer of shares to the Demat account of IEPF Authority. Concerned Shareholders holding shares in dematerialized form may note that Company shall inform the depository by way of corporate action for transfer of shares to the Demat account of IEPF Authority.

The concerned Shareholders are requested to claim the unclaimed dividend due to them by making an application immediately along with the necessary documents mentioned in the letter and send it to Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent ("RTA"), 5th floor, 506-508, Amarnath Business Centre-1 (ABC-1), Besides Gala Business Centre, Near St. Xavier's College Corner, Off C. G. Road, Ellisbridge, Ahmedabad – 380 006. Tel: +079-26465179. Email: ahmedabad@linkintime.co.in. Website: www.linkintime.co.in.

The concerned Shareholders are also requested to immediately communicate to the Company with the copy of the Order in case of injunctions / restraint orders, etc. obtained from any Court / Statutory Authority with respect to transfer of shares or payment of dividend, etc.

The Shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded as an adequate notice is respect of transfer of shares to the Demat account of IEPF Authority.

The Shareholders may note that both the unclaimed dividends and the shares transferred to IEPF Authority including all benefits accruing on such shares, if any, can be claimed by the Shareholder from IEPF Authority by making an online application in the prescribed web Form IEPF-5 and sending the physical copy of the same, duly signed (as per the specimen signature recorded with the Company) along with the requisite documents enumerated in the web Form IEPF-5 to Company at the above mentioned address. Also, note that no claim shall lie against the Company in respect of unclaimed dividend and shares transferred to IEPF Authority pursuant to the said Rules.

In case the Company does not receive any communication from the concerned Shareholders by September 6, 2024, the Company shall, with a view to comply with the requirements set out in the Rules, transfer the shares to the Demat account of IEPF Authority by the due date as per procedure stipulated in the Rules.

Securities and Exchange Board of India ("SEBI") vide its Master Circular dated May 17, 2023 has prescribed mandatory provisions for "Common and Simplified Norms for processing Investor's Service Request by RTAs and norms for furnishing PAN, KYC details and Nomination." Further, it has made mandatory for the Members holding securities in physical form to furnish PAN, KYC details and Nomination to the RTA of the Company. More details of the above are available on the website of the Company https://www.torrentpower.com/index.php/investors/holdingshares.

In case the Shareholders have any queries on the subject matter, they may contact the Company's RTA or to the Company at the aforementioned address.

Place: Ahmedabad Date : June 04, 2024 For Torrent Power Limited Rahul Shah Company Secretary

IndusInd Bank

IndusInd Bank Limited CIN: L65191PN1994PLC076333

Registered Office: 2401, Gen. Thimmayya Road (Cantonment), Pune – 411 001; Tel.: (020) 6901 9000 Secretarial & Investor Services Cell: 701, Solitaire Corporate Park, 167, Guru Hargovindji Marg, Andheri (East), Mumbai - 400 093; Tel.: (022) 6641 2487 / 2359 E-mail ID: investor@indusind.com; Website: www.indusind.com

NOTICE OF POSTAL BALLOT

NOTICE is hereby given that pursuant to Sections 108 and 110 of the Companies Act, 2013 (the "Act") and other applicable provisions, if any, of the Act and Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("Rules"), as amended from time to time, read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No.22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020, General Circular No. 39/2020 dated December 31, 2020, General Circular No. 10/2021 dated June 23, 2021, General Circular No. 20/2021 dated December 8, 2021, General Circular No. 3/2022 dated May 5, 2022 General Circular No. 11/2022 dated December 28, 2022 and General Circular No. 9/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs ("MCA") (hereinafter collectively referred to as "MCA Circulars"), Secretarial Standard on General Meeting ("SS-2") issued by the Institute of Company Secretaries of India, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force and subject to other applicable laws and regulations, the Resolutions as set out in the Notice are proposed to be passed by the Members of IndusInd Bank Limited ("the Bank") by means of Postal Ballot, only by voting through electronic means (remote e-voting).

In accordance with the Act and MCA Circulars, the Bank has completed the dispatch of Postal Ballot Notice on June 3, 2024, in electronic form only to those Members who have registered their email address with the Bank / Registrar & Share Transfer Agent of the Bank ('RTA') (Link Intime India Private Limited) / Depository Participants (DP) and whose names appear in the register of members/ register of beneficial owners as received from the depositories as on May 31, 2024 ("cut-off date"). The said Notice is also available on the website of the Bank at www.indusind.com and the websites of the Stock Exchanges, i.e., BSE Limited at www.bseindia.com and The National Stock Exchange of India Limited at www.nseindia.com and on the National Securities Depository Limited's (NSDL) website at www.evoting.nsdl.com

In accordance with the MCA Circulars, the Members can vote only through the remote e-voting process. A person whose name appears in the Register of Members/List of Beneficial Owners as on the cut-off date shall be entitled to vote through remote e-voting process on the resolution as set out in the said Notice of Postal Ballot.

Any person who is not a Member as on the cut-off date should treat this Notice for information purpose only.

The Bank has engaged NSDL to provide remote e-voting facility. The procedure for remote e-voting is given in the said Notice of Postal Ballot.

The remote e-voting shall commence from Wednesday, June 5, 2024 (9:00 A.M. IST) and remain open up to Thursday, July 4, 2024 (5:00 P.M IST). Remote e-voting shall not be allowed beyond the said date and time and shall be forthwith disabled by NSDL. Once the vote on resolution is cast by the Members, the Members shall not be allowed to change it subsequently or cast the vote again.

Members of the Bank, who have not yet registered their email address and mobile number, are requested to register the same immediately with their DP in respect of shares held in electronic form and by communicating to Link Intime India Private Limited in respect of shares held in physical form.

The Board of Directors of the Bank have appointed Mr. Alwyn D'souza (C.P. No. 5137), or failing him Mr. Jay D'souza (C.P. No. 6915) from Alwyn Jay & Co., Company Secretaries, as the Scrutinizer to scrutinize the remote e-voting process in a fair and transparent manner.

The result of the Postal Ballot will be declared within two working days of conclusion of remote e-voting process i.e. on or before Saturday, July 6, 2024. These results will be communicated to the Stock Exchanges and will be uploaded on the website of the Bank at www.indusind.com. The said results will also be displayed at the Registered and Corporate Office of the Bank.

In case of any query(s), the Members may refer to the 'Frequently Asked Questions' (FAQs) for Members and the e-Voting User Manual for Members available at the download section of www.evoting.nsdl.com / call on 022 4886 7000 / send a request at evoting@nsdl.com. Alternatively, you may contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL on 022 4886 7000 or write to her at Trade World, 'A' Wing, 4" Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, and Mumbai-400 013.



For IndusInd Bank Limited

Anand Kumar Das Company Secretary (F6950)

Ahmedabad

financialexp.epapr.in

SBFC

SBFC Finance Limited

(Erstwhile SBFC Finance Private Limited) CIN No: U67190MH2008PLC178270

NOTICE OF 17[™] ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE AND/OR OTHER AUDIO-VISUAL MEANS

NOTICE is hereby given that the 17th Annual General Meeting ("AGM") of SBF0 Finance Limited ("the Company") is scheduled to be held on Friday, June 28 2024 at 3:00 P.M. (IST), through Video Conferencing (VC) and/ or Other Audio Visual Means (OAVM). In compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder read with circulars dated April 8, 2020, May 5, 2020, May 5, 2022, December 28, 2022 and September 25 2023, issued by the Ministry of Corporate Affairs (MCA) and circulars dated May 12, 2020, January 15, 2021, May 13, 2022 and January 5, 2023 issued by SEB to transact the business set forth in the Notice of the AGM dated April 27, 2024.

The Company has entered into an arrangement with KFin Technologies Limited ("KFIN") for facilitating conduct of the AGM through Video Conferencing (VC) Other Audio Visual Means (OAVM). In terms of Section 108 of the Companie Act, 2013 ("the Act") read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), as amended, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the Company has also provided the remote e-voting facility through KFIN.

Electronic copies of the Notice of the AGM and Annual Report of the Company for the year ended March 31, 2024, will be sent to all the members whose ema addresses are registered with the Company/ Depository Participant(s). The said documents will also be made available on the Company's website www.sbfc.com and on the websites of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and the website of KFIN at https://evoting.kfintech.com. Members can join and participate in the 17th AGM through VC/OAVM means only.

The instructions for joining the AGM and the procedure for remote e-voting fo casting vote through the e-voting system during the AGM, will be provided in the notice of the AGM which will be sent to the shareholders along with logir credentials. Members participating through VC/OAVM means shall be counted for the purpose of reckoning quorum under Section 103 of the Companies Act 2013.

Members holding shares in dematerialised mode are requested to register/update their email addresses with the relevant Depository Participants Members holding shares in physical mode are requested to update their emai addresses with the Company's Registrar and Share Transfer Agent (RTA), KFir Technologies Limited at einward.ris@kfintech.com with a copy to companysecretary@sbfc.com by sending a scanned copy of the signed reques letter mentioning their folio no, name, scanned copy of the share certificate (fron and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned attested scanned copy of Aadhar card) for registering their email address. The login credentials for casting the votes through e-voting shall be made available to the members through email at their registered email addresses as mentioned

The notice of AGM and Annual Report of the Company for the year ended March 31, 2024, will be sent to the members in accordance with the applicable laws or their registered email addresses in due course. The above information is being issued for the information and benefit of all the members of the Company and is n compliance with the MCA Circular(s) and the SEBI Circular(s)

Place : Mumbai Date : June 04, 2024

For SBFC Finance Limited Jay Mistry Company Secretary & Chief Compliance Office ICSI Membership No.: ACS 34264

Registered Office: Unit No. 103, 1st Floor, C&B Square, Sangam Complex Andheri Kurla Road, Village Chakala, Andheri (East) Mumbai - 400 059 T.: +91-22-67875300 F: +91-22-67875344 W: www.sbfc.com E: complianceofficer@sbfc.com



વેબસાઈટ : www.torrentpower.com

ટોરેન્ટ પાવર લિમિટેડ

૨જિ. ઓક્સિ: "સમન્વય" ૬૦૦ તપોવન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ (ગજરાત) ભારત होनः +८९ - ७८-२६६२८३०० ઇ-મેલઃ cs@torrentpower.com

नोर्हिस

(કંપનીના ઈક્વિટી શેરધારકોને જાણ અને તાત્કાલિક કાર્ચવાહી માટે)

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૨૪ (ફ) સાથે વંચાણે લેતા, ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટાન્સક્ટ એન્ડ રીકંડ) રૂલ્સ, ૨૦૧૬ (તેમજ સમયાંતરે તેમાં થયેલા સુધારા મુજબ), કંપનીના ઈક્વિટી શેર્સ કે જેનુ ડિવિડન્ડ સતત સાત વર્ષ અથવા તેથી વધુના સમયગાળા માટે શેરધારકો દ્વારા ક્લેઈમ થયુ નથી, તે ઈક્વીટી શેર્સને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ("આઈઈપીએફ") ઓથોરિટીના ડિમેટ એકાઉન્ટમાં ફરિવચાત પણે ટ્રાન્સફર કરવામાં આવશે.

જે શેરધારકોના શેર ઉપરોક્ત રૂલ્સ અનુસાર આઇઇપીએફમાં તબદીલ કરવા જરૂરી છે, તેમને કંપની દ્વારા વ્યક્તિગત સંદેશાવ્યવહાર કરવામાં આવેલ છે. કંપનીએ સંબંધિત શેરધારકોની સંપૂર્ણ વિગતો તેની વેબસાઈટ www.torrentpower.com પર ઉપલબ્ધ કરેલ છે.

સંબંધિત શેરધારકો, ફિઝીક્લ સ્વરૂપે શેર ધારણ કરતા હોય અને જેમના શેર્સ આઇઇપીએફના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જરૂરી છે, તેમને જણાવવાનું કે કંપની દ્વારા અસલ શેર સર્ટિફિકેટ કે જે શેરધારકો પાસે છે, તેના બદલામાં નવા શેર સર્ટિફિકેટ જારી કરવામાં આવશે અને ઓરિજાનલ શેર સર્ટિફિકેટ क्रेमना नामे छे ओ शेर सर्टिङ्किडेट स्वयं डेन्सल थए अने ते रह्*जात*ल मानी લેવામાં આવશે. આઇઇપીએફના ડિમેટ એકાઉન્ટમાં શેર્સ ટ્રાન્સફર કરવા માટે કંપની કોર્પોરેટ એક્શનના માધ્યમથી નવા શેર સર્ટિફિકેટ ને ડિમેટમાં કરવા માટે ડિપોઝિટરીને જાણ કરશે. એવા શેરધારકો કે જે લોકો ડિમેટમોડમાં શેર્સ દ્યારણ કરતા હોય તેમને જણાવવાનું કે કંપની તેમના શેર્સ આઇઇપીએફના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કોર્પોરેટ એકશનના માધ્યમથી ડિપોઝિટરીને

સંબંધિત શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેમણે ક્લેઇમ નહીં કરેલા ડિવિડન્ડનો ક્લેઇમ તેઓ તુરંત જ એક અરજી કરીને તેની સાથે પત્રમાં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી લિંક ઇન્ટાઇમ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, રજસ્ટાર અને શેર ટાન્સકર એજન્ટ ("આરટીએ"), પાંચમો માળ, ૫૦૬-૫૦૮, અમરનાથ બિઝનેસ સેન્ટર-૧ (એબીસી-૧), ગાલા બિઝનેસ સેન્ટરની બાજુમાં સેન્ટ ઝેવિચર્સ કોલેજ કોર્નર નજીક, ઓફ સી .જી .રોડ, એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦૦૦६. ફોન: +૦૭૯ ૨૬૪૬૫૧૭૯, ઇમેલ: <u>ahmedabad@linkintime.com</u>

વેબસાઇટ: www.linkintime.co.in; ને મોક્લી આપે. સંબંધિત શેરધારકોને એવી પણ વિનંતી કરવામાં આવે છે કે શેર્સના ટ્રાન્સફર અથવા ડિવિડન્ડની ચકવણી વગેરે સામે કોઇ મનાઇ હક્મ / નિયંત્રણ આદેશો વગેરે કોઇ કોર્ટ / વૈદ્યાનિક સત્તા પાસેથી મેળવવામાં આવ્યા હોય તો તેની એક નકલ સાથે કંપનીને તે બાબતે તાત્કાલિક જાણ કરવામાં આવે .

शेरधारङोओ नोंध दोवी डे डंपनी द्वारा संजंधित शेरहोट्डर्सनी विशतो तेनी વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે અને તેને આઇઇપીએફ ઓથોરિટીનાં ડિમેટ એકાઉન્ટમાં શેર્સ ટ્રાન્સફર કરવા માટે પર્ચાપ્ત નોટિસ માનવામાં આવશે.

शेरधारङों भेनी पण नोंध तेवी हे अनडतेछन्ड डिविडन्ड अने शेर्स हे ९ આઇઇપીએફ ઓથોરિટી ખાતે તબદીલ થઇ ગયેલા હોય અને તે શેર્સ ઉપરના બધાજ લાભો જો પરત મળેવવા માંગતા હોય તો તેમને વેબ ફાર્મે આઇઇપીએફ - ૫ માં ઓનલાઇન એપ્લીકેશન કરી સહી કરેલ (કંપની સાથે નોંધાયેલા નમુનાના હસ્તાક્ષર મુજબ) વેબ ફોર્મ તેમાં જણાવેલ આવશ્ચકતા મુજબના દસ્તાવેજો જોડીને કંપનીને ઉપર જણાવેલ સરનામે મોકલાવી આપવા. વધુમાં જણાવવાનું કે રૂત્સના અનુસંધાનમાં કંપની દ્વારા અનકલેઇમ્ડ ડિવીડન્ડ અને શર્સ કે જે આઇઇપીએફ ઓથોરિટીમાં ટ્રાન્સફર કરવામાં આવશે, તેના અંગે કંપની વિરૂધ્ધમાં કોઇ દાવો કરી શક્શે નહીં.

જો કંપનીને સંબંધિત શેરધારકો તરફ થી સપ્ટેમ્બર દૃ, ૨૦૨૪ સુધીમાં કોઇ જવાબ નહી મળે તો કંપની રૂસમાં નિર્દિષ્ટ આવશ્ચકતાઓ પુરી કરવા અને રૂલ્સમાં નિયત કરાયેલી કાર્યવાહી અનુસાર શેર્સ આઇઇપીએફ ઓથોરિટીના ડિમેટ એકાઉન્ટમાં ટાન્સકર કરશે.

સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ તેના મે ૧૭, ૨૦૨૩ના મુખ્ય પરિપત્રમાં, RTAએ દ્વારા શેરહોલ્ડર્સની સર્વિસની વિનંતી પ્રક્રિયા કરવા માટેના સામાન્ય અને સરળ ધોરણો અને પાન, કેવાયસીની વિગતો અને નામાંકન આપવા માટે ફરજિયાત જોગાવઇ કરી છે. વધુમાં તેમાં ફીજીકલ સ્વરૂપમાં સિક્ચોરીટીઝ ધરાવતા સભ્યો માટે પાન, કેવાયસીની વિગતો અને નામાંકન કંપનીના RTAને આપવાનું ફરિજયાત કરેલ છે. ઉપર જણાવેલ વિગતો વધ્માં કંપનીની વેબસાઇટ <u>https://www.torrentpower.com/index.php/</u> investors/holdingshares પર ઉપલબ્ધ છે.

શેરદારકોને ઉપર દર્શાવેલ બાબતમાં કોઈ પ્રશ્નો હોય તો તેઓ કંપનીના આરટીએ અથવા કંપનીને ઉપર દર્શાવેલ સરનામા ઉપર સંપર્ક કરવો.

ટોરેન્ટ પાવર લિમિટેડ વતી સ્થળઃ અમદાવાદ તારીખઃ જૂન ૪, ૨૦૨૪

રાહુલ શાહ કંપની સેક્રેટરી



રીજનલ ઓફિસ, અમદાવાદ : ધી સાઉથ ઈન્ડિયન બેંક લિં, રીજનલ ઓફિસ, અમદાવાદ : ચોથો માળ, સાકાર - VII, નેહરૂ બ્રીજ જંકશન, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯ ફ્રોન નં. ૦૭૯-૨૬૫૮૫૬૦૦,૫૭૦૦ ઈમેલ : ro1018@sib.co.in

ક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (અધિનિયમ) ૨૦૦૨ તથા સિક્યોરિટ ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮(૬) અને ૯(૧) ની જોગવાઈ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટિસ

ડવારકતાઓ 1.**શ્રી રમેશ બાબુલાલ ગોર** પ્લોટ નં.દ્રપ, શેરી નં.૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ,ભાનુશાલી નગર, ભુજ, કચ્છ-39000૧ **2.શ્રીમતી નેહા રમેશ ગોર** પ્લોટ નં.દ્રપ, શેરી નં.૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ભાનુશાળી નગર, ભુજ, કચ્છ 39000૧ **3.શ્રી હર્ષદ બાબુલાલ ગોર,** પ્લોટ નં.દ્રપ, શેરી નં.૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ 39000૧ **4.શ્રીમતી મનીષા હસમુખ ગોર,** પ્લોટ નં.દ્રપ, શેરી નં.૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ 39000૧ આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને ઉદ્યારકર્તા / જમીનદાર ને નોટિસ આપવામાં આવે છે કે નીચે જણાવેલી સ્થાવર મિલકત સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ

શાખા ભુજ (સિક્યોર્ડ ક્રેડિટર)ને ગીરવે મૂકવામાં આવી છે. જેનો પ્રત્યક્ષ કબજો ધ સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ ના અધિકત અધિકારી (સિક્યોર્ડ ક્રેડિટર) દ્વારા નેવામાં આવ્યો છે. તે તા. **૨૫.૦૬.૨૦૨૪** ના રોજ તે **"જે જેમ છે ત્યાં છે" "જેમ છે તેમ" અને "જે ત્યાં છે તેમ" ના આધારે વેચવામાં આવશે. ધી સાઉથ ઈન્ડિયૂન બેંક લિં, ભુજ (સિક્યોર્ડ ક્રેડિટર) પાસેથી ભવિષ્યના વ્યાજ, ખર્ચ અને ખર્ચ વગેરે સાથે ૦૨.૦૬.૨૦૨૪ ના રોજ રૂ. ૩,૮૨,૪૮,૩૦૯.૩૩ (રૂપિયા ત્રણ કરોડ ાસી લાખ અડતાલીસ હજાર ત્રણસો નવ અને તેત્રીસ પૈસા પુરા)** ની રકમની વસૂલાત માટે.

| શ્રી હર્ષદ બાબુલાલ ગોર |
|--|
| શ્રી હર્ષદ બાબુલાલ ગોર ની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૧૭૮.૩૪ સ્કે.મી., સંયુક્ત રેવન્યુ સર્વે નં. ૪૪૪૧-એ અને બી, જુનો સર્વે નં. ૯૯૭/૧, ભુજ ગામ, ભુજ તાલુકો, કચ્છ - જીલ્લો, જે સ્થિત પ્લોટ નં. ૧૫, ભાગ - એ (પ્લોટ નં. ૧૫-એ તરીકે ઓળખાયેલ), સીટી સર્વે વોર્ડ નં. ૫, સર્વે એન્ટ્રી નં. ૧૬૩૭, ભાનુશાલી નગર, કર્મભૂમી એપાર્ટમેન્ટના નામે રહેણાંક મકાન સાથે, પ્લિન્થ એરીયાનું આશરે ૨૯૨.૫૧ ચો.મી, તેમાં કરવામાં આવેલ અન્ય તમામ સુવિધાઓ સાથે. એસ.આર.ઓ. ભુજની તા. ૧૬.૦૧.૧૯૯૮ ના સેલ ડીડ નં. ૧૮૧/૧૯૯૮ માં વધુ સંપૂર્ણ રીતે વર્ણવેલ. ચતુઃ સીમા :- ઉત્તરે : વરસાદી પાણી માટેની જગ્યા, દક્ષિણે : પ્લોટ નં. ૬૬-એ, પૂર્વે : ૨૦મી. આંતરીક રીડ, પશ્ચિમે : પ્લોટ નં. ૬૪-એ. |
| રૂ. ૧,૦૫,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ પાંચ લાખ પુરા) |
| રૂ. ૧૦,૫૦,૦૦૦/- (રૂપિયા દસ લાખ પચાસ હજાર પુરા) ઇએમડી ૨૪.૦૬.૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી જમા કરવામાં આવશે |
| રૂ. ૧૦,૦૦૦/- (રૂપિયા દસ હજાર પુરા) |
| રપ.૦૬.૨૦૨૪ સુધી બપોરે ૧૨.૦૦ થી ૦૧.૦૦ વાગ્યા સુધી (વેચાણ પૂર્ણ થાય ત્યાં સુધી 5 મિનિટના અમર્યાદિત ઓટો એક્સ્ટેન્શન સાથે) |
| નથી |
| |

વેચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે, કૃપા કરીને સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડના વેબ પોર્ટલ (સિક્યોર્ડ ક્રેડિટર) વેબસાઇટ એટલે http://www.southindianbank.com પર પ્રદાન કરેલી લિંકનો સંદર્ભ લો. http://www.bankauctions.in/ પર પણ વિગતો ઉપલબ્ધ છે. ોલકતની ચકાસણી, ઈ-હરાજીના નિયમો અને શરતો અથવા બિડ રજૂ કરવાના સંબંધમાં વધુ કોઈ સ્પષ્ટતા માટે શ્રી અકિલ મણિયાર, રિકવરી ઓફિસર, ક્ષાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ - અમદાવાદ રિજનલ ઓફિસનો +91 9284647412 સંપર્ક કરો.

અધિકૃત અધિકાર્ર ધી સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ ાંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે) તારીખ: ૦૩.૦૬.૨૦૨૪



ઇિક્સિન ઓવરસીઝ બેંક એસેટ રીકવરી મેનેજમેલ્ટ બ્રાન્ચ (સ્પર્ગ-અમદાવાદ ગ્રાઉન્ડ ફ્લોર, શરદ શોપીંગ સેન્ટર, ચીનુભાઇ ટાવર, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ ઇ-મેઇલઃ iob2581@iob.in, વેબઃ www.iob.in ફોન હલ્સ્ટ૮૧૩૯૭૯

સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ (સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમોના નિયમ ૮ (૬) અને ૬ (૨) ની જોગવાઇઓ હેઠળ)

સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૮(૬) અને ૬(૨) ની જોગવાઈઓ સાથે વંચાતા સિક્ચોરીટાઈઝેશન એન્ડ रिકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ કાયદો, ૨૦૦૨ હેઠળ સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ

માથી ખાસ કરીને દેવાદાર/રો અને જામીનદાર/રો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ **સ્થાવર મિલકતો** સિક્ચો: લેણદારને ગીરો/ચાર્જડ કરાચેલ છે અને જંગમ મિલકતો સિક્ચોર્ડ લેણદારને હાઈપોથીકેટેડ/ચાર્જડ કરાચેલ છે, જેનો **પ્રત્યક્ષ કબજો** ઈન્ડિચન ઓવરસીઝ બેંક, સિક્ચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે, જેનું જ્યાં છે હતો અને જેમ છે તેમના ધોરણે સિક્ચોર્ડ લેણદારની તા. ૦૧/૦૬/૨૦૨૪ મુજબની બાકી નીકળતી ૨૬મ રૂા.૩૯,૬૮,૭૫,૪૨૨.૪૨ (રૂા. ઓગણચાલીસ કરોડ અડસઠ લાખ પંચોતેર હજાર ારસો બાવીસ અને બેતાલીસ પૈસા પુરા) અને રૂા. ૬૧,૪૫,૦૦૦.૦૦ (રૂા. એક્સઠ લાખ પીસ્તાલીસ હજાર પુરા)ની આકસ્મિક જવાબદાર દેવાદાર મે. માદવ ફેબ્રીક્સ, જામીનદારો શ્રી અખીલેશ ચંદ્રમોહન મહેશ્વરી, શ્રીમતી રાદીકા અખીલેશ મહેશ્વરી અને ગીરવેદારો મે. માદવ ફેબ્રીક્સ, શ્રી અખીલેશ ચંદ્રમોહન મહેશ્વરી પારોથી વસુલાત માટે તા. ૨૧/૦૬/૨૦૨૪ના રોજ વેચાણ કરવામાં આવશે .

| | સિક્ચોર્ડ એસેટ્સનું વર્ણન | | |
|-----------|--|---|---------------------------------|
| સં. ક. | સિક્ચોર્ડ એસેટ્સનું વર્ણન # | રીઝર્વ કિંમત | અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી) |
| 1 | સ્થાવર મિલકત જે બલરામ એસ્ટેટ, પ્લોટ નં. ર3થી ૫૦ (૨૮ પ્લોટ્સ), ર૦૪ થી ૨૨૪ (૨૧ પ્લોટ્સ), ૨૨૭ થી ૨૮૯ (ફ૩ પ્લોટ્સ)(ફુલ ૧૧૨ પ્લોટ્સ) જે બ્લોક નં. ૯૯૭, આર.એસ. નં. દ્રદૃદૃ[૧/એ, દૃદૃ૧/૧/બી અને દૃદૃદૃ[૧બી છે તે ગામ — તાડકેશ્વર, તાલુકો - માંડવી, જિલ્લા - સુરત, ગુજરાત ખાતે આવેલ છે, તે શ્રી. અખિલેશ ચંદ્રમોહન મહેશ્વરીના નામે છે. કુલ અરિચા ૧૧૨ પ્લોટ્સનો ૯,૯૯૯ ૭૬ ચો.મી. (૧૧,૯૫૯ ૬૫ ચો.વા૨) છે. | રૂા. ૨,૬૩,૦૦,૦૦૦/- | ३।. २५, ३०,०००/- |
| 2 | ફેક્ટરી જેનો પ્લોટ નં. ૨૯૦ થી ૩૪૩ (કુલ ૫૪ પ્લોટ્સ) જેનો બ્લોક નં. ૯૯૬,આર એસ નં. ૬૬૬/૧/એ, ૬૬૬/૧/બી અને ૬૬૬/૧બી, સુબતા સિલ્થેટિક્સની બાજુમાં, બલરામ એસ્ટેટ જે ગામ - તાડકેશ્વર, તાલુકો - મોડવી, જિલ્લા- સુરત, ગુજરાત ખાતે આવેલ છે તે શ્રી. અખિલેશ ચંદ્રમોહન મહેશ્વરીના નામે છે. કુલ એરિયા ૫૪ પ્લોટનો ૫,૩૧૭,૦૦ ચો.મી.(૬,૩૫૯.૧૩ ચો.લા૨) છે. | રૂા. ૫,૧૬,૦૦,૦૦૦ <i> -</i> (૧% ટીડીએસ સહિત) | રૂા. ૫૧,૬૦,૦૦૦/- |
| 3 | પ્લાન્ટ અને મશીનરી તથા અન્ય જંગમ મિલકતો જે ફેક્ટરી પ્રીમાઇસીસમાં જેનો પ્લોટ નં. ૨૯૦ થી ૩૪૩ (ફુલ ૫૪ પ્લોટ્સ) છે તેનો પ્લોક નં. ૯૯૬, આર.એસ. નં. ૬૬૬/૧/એ, ૬૬૬/૧/બી અને ૬૬૬/૧બી, સુજતા સિન્થેટિક્સની બાજુમાં બલરામ એસ્ટેટ ખાતે ગામ - તાડકેશ્વર, તાલુકો - માંડવી, જિલ્લો સુરત, ગુજરાત ખાતે આવેલ છે. | રૂા. ૩,૨७,૦૦,૦૦૦/- (વત્તા લાગુ જીએસટી) | રૂા. ૩૨,७०,०००/- |

‡ ઉપરોક્ત ક્રમ સંખ્યા ૧ અને ૨ પરની મિલકતો એક સાથે ખરીદવા / બોલી લગાવવાની હોય છે અને તેના વેચાણની પૂષ્ટિ ત્યારે જ કરવામાં આવશે ઉપરોક્ત ક્રમ સંખ્યા ૩ પરની મિલકત પણ વેચવામાં આવી હોચ.

ઈ-હરાજીની તારીખ અને સમય : ૨૧.૦૬.૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ કલાકે. મિલકત નિરીક્ષણની તારીખ અને સમય : ૧૫.૦૬.૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ની વચ્ચે. તણમાં હોય તેવા બોજા. જો કોઈ હોય તો : બેંકની જાણકારી અનસાર નથી

ોચાણની વિગતવાર શરતો અને નિચમો માટે. સિક્ચોર્ડ લેણદારની વેબસાઇટ **www.iob.in** અને ઈ-હરાજા સર્વિસ પ્રદાતાના વેબપોર્ટલ nttps://www.ibapi.in અને https://www.mstcecommerce.com/auctionhome/ibapi માં આપેલ લિંક જોવા ોઈપણ પૂછપરછ માટે, પ્રસ્તાવિત બીડર્સ **શ્રી હરફુલ મીણા, ચીફ મેનેજરનો મો. નં. ૯૯૨૮૮૧૩૯७૯ અને શ્રી કપિલ રાઠોડ, મેનેજરનો મો. નં. ૮૯૫૫७૨૦૮૫૫** પર સંપર્ક કરી શકે છે. તારીખ : ૦૧/૦૬/૨૦૨૪ સ્થળ : અમદાવાદ ઈન્ડયન ઓવરસીઝ બેંક

ઉચ્ચતમ સફળ બીડરે આવક વેરા કાયદાની કલમ ૧૯૪ (ઓ) હેઠળ વેચાણ કિંમતના ૧% ટીડીએસ તરીકે ચૂકવવાના રહેશે. નોધ : વિવાદની સ્થિતિમાં અંગ્રેજી આવૃત્તિમાં પ્રકાશિત થયેલ નોટીસ માન્ય ગણાશે.

આ નોટીસ ઉપર જણાવેલ તારીખે ઇ-હરાજી ચોજવા અંગે જણાવેલ લોનના દેવાદ (૬), નિચમ ૯(૧) અને નિચમ ૬(૨) હેઠળ નોટીસ તરીકે પણ ગણવાની રહેશે.

Regd. Office: 7th Floor, Eleven West Panchshil, Survey No. 25, Near PAN Card Club Road, Baner, Pune - 411 069 Tel.: +91 20 682 81 200 Email: shares@sudarshan.com Website: www.sudarshan.com CIN: L24119PN1951PLC008409

■ NOTICE I

(For attention of the Equity Shareholders of the Company) Transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund (IEPF)

This Notice is published pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013, ("the Act"), read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("Rules"), notified by The Ministry of Corporate Affairs, with respect to transfer of unclaimed dividend amount and respective shares related to such amount to Investor Education and Protection Fund ("IEPF") Suspense Account.

The Rules inter alia, contain provisions for transfer of all such shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more in the name of IEPF Suspense Account.

To comply with the requirements as set out in the Rules, communication is being sent at the latest available addresses of the concerned shareholders whose shares are liable to be transferred to the IEPF Suspense Account. The Company has also made available a list of such shareholders and shares due for transfer to IEPF

Suspense Account on its website at www.sudarshan.com under the head 'Investors' and shareholders are requested to refer the website to verify details of unencashed / unclaimed dividend and respective shares that are liable to be transferred to IEPF Suspense Account. Shareholders may note that both, unclaimed dividend and respective shares transferred to IEPF

Suspense Account including all benefits accruing on such shares, if any, can be claimed back from IEPF Authority, after following the procedure prescribed by Rules, and which is available on the website: www.iepf.gov.in. Please note that no claim shall lie against the Company in respect of such unclaimed dividend amount and shares transferred to IEPF Suspense Account.

The Shareholder(s), whose equity shares are liable to be transferred to the IEPF Suspense Account, may kindly note that as per Rules:-

- In case of Equity Shares held in Physical form: Duplicate Share Certificate(s)/Letter of Confirmation(s) will be issued and the concerned depository shall convert the Duplicate Share Certificate(s)/Letter of Confirmation(s) into demat form and shall transfer the shares in favour of the IEPF Suspense Account. The original Share Certificate(s) registered in the shareholders' names will stand automatically cancelled and deemed non-negotiable;
- In case of Equity Shares held in Demat form: Concerned depository will give effect to the transfer of the equity shares liable to be transferred in favour of the IEPF Suspense Account by way of corporate action.

The shareholders may further note that details uploaded by the Company on its website should be regarded and shall be deemed as adequate notice in respect of issue of the Duplicate Share Certificate(s)/Letter of Confirmation(s) by the Company for the purpose of transfer of dividend and shares to IEPF Suspense Account as prescribed by Rules

Notice is hereby given to all such shareholders to make an application to the Company / Registrar and Share Transfer Agent ("RTA") of the Company with a valid request duly signed by all holders along with necessary documents for claiming the unclaimed dividend, so that the shares are not transferred to the IEPF Suspense Account. It may be please noted that if no valid claims are received in respect of such shares from the shareholders latest by 4th September, 2024, then the Company shall, with a view to comply with requirements, transfer the unclaimed dividend amount (Final Dividend) for FY 2016-17 and consequently transfer such shares to IEPF Suspense Account by the due date, as per the procedure stipulated in the Rules.

For further information / clarification / assistance, concerned shareholders are requested to contact the

| RTA of the Company and / or the Company at below in | nentioned addresses: |
|---|---|
| LINK INTIME INDIA PRIVATE LIMITED ("RTA") | SUDARSHAN CHEMICAL INDUSTRIES LT |
| Unit : Sudarshan Chemical Industries Limited | Legal and Secretarial Department, |
| Block No. 202, Akshay Complex, Near Ganesh | 7 th Floor, Eleven West Panchshil, |
| Temple, off Dhole Patil Road, Pune - 411 001, | Survey No. 25, Near PAN Card Club Road, |
| Maharashtra. Tel.: 020 - 2616 0084 / 2616 1629 | Baner, Pune - 411 069, Maharashtra |
| Fax: 020 - 2616 3503 | Tel.: 020 - 68281200 |
| e-mail : ienf shares@linkintime co in | F-mail: shares@sudarshan.com |

For Sudarshan Chemical Industries Limited

Mandar Velankar Date : 03rd June, 2024 **General Counsel & Company Secretary**

adani

Adani Enterprises Limited

NOTICE is hereby given that below mentioned Share Certificate is reported lost/misplaced/stolen.

| Name of Shareholder | Certificate No. | No. of Shares | Distinctive Nos. | L.F. No. |
|------------------------|--------------------|------------------|-------------------------|-------------|
| Shravan Sahni | 50124 | 1000 | From 1336801 to 1336900 | 010124 |
| | | | (Both inclusive) | |

Any person who has claim/interest in the said Equity Shares and having any objection to the issue of Duplicate Share Certificates in lieu of the above may write to the Company with supporting documents within 7 days of publication or failing which the Company shall proceed to issue Duplicate Share Certificate in lieu of the same

> For Adani Enterprises Limited Jatin Jalundhwala

Place: Ahmedabad Date: 03.06.2024

Company Secretary & Joint President (Legal)

Registered Office: "Adani Corporate House", Shantigram, Nr. Vaishno Devi Circle,

S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Gujarat, India | Phone No.: +91-79-26565555 Fax No.: +91-79-25555500 | Website: www.adanienterprises.com | CIN: L51100GJ1993PLC019067

MUTHOOT FINCORP LTD. સોનાનાં દાગીના ફરાજી નોટીસ

Regd. Office: Muthoot Centre, TC No 27/ 3022, Punnen Road, Thiruvananthapuram, Kerala, India - 695001. CIN: U65929KL1997PLC011518, Ph: +91 471 4911400, 2331427

30.06.2023 & MSGL, SPL-16, One plus, Guide Prepaid, Super value, ADGL and all other 6 months tenure Gold loans up to 30.09.2023 and MSGB, SME Suvarna & EM ue up to 31.03.2024 સુધીના સમયગાળા માટે કંપનીની નીચે દરાવિલ શાખાઓ સાથે જેમણે સોનાના દાગીના ગીરવે મૂકેલ હોય તે તમામની જાણ માટે નોટિસ આપવામાં આ એ કે ગીરોમુક્તિ માટે આ સમયગાળો પૂર્ણ થઇ ગયો છે અને વારંવાર નોટિસો આપવા છતાં દુજુ તેને ગીરોમુક્ત કરાવવામાં આવ્યાં નથી, તારીખ 11.06.2024 ના રોજ સવારે 1 પ્રાપ્ટાથી આ દાગીતાઓતી કગજ કરવામાં આવશે

HMEDABAD-RELIEF ROAD: 3171000023, 3171000025, 3171000030, 3171000035, 3171000038, 3171000047, 3171000056, F2504, F2691, F2709, F2710 F2712, F2718, F2731, F2763, F2789, F2832, F2893, F3029, F3033, F3044, F3080, F3128, F3129, F3156, F3157, F3158, F3160, F3161, F3167, F3168, F3169 F3171, F3178, F3183, F3186, F3200, F3202, F3235, F3241, F3248, F3249, F3252, F3253, F3254, F3259, F3267, F3268, F3272, F3273, F3274, F3283, F3284 -3171, 1-3176, 1-3163, 1-3160, 1-3200, 1-3202, 1-3223, 1-3241, 1-3246, 1-3248, 1-3262, 1-3259, 1-3269, 1-3267, 1-3268, 1-3267 3-3285, 1-3287, 1-3290, 1-3294, 1-3295, 1-3300, 1-3310, 1-3311, 1-3312, 1-3316, 1-3317, 1-3319, 1-332, 1-3325, 1-3325, 1-3326, 1-3327, 1-3336, 1-3326, 1 F8373, F8386, F8389, F8401, F8403, F8405. BAVLA: 2587000025, 2587000026, 2587000032, 2587000043, 2587000048, 2587000056, 2587000065, 2587000065 2587000173, 2587000076, 2587000082, 2587000102, 2587000116, 2587000116, 2587000112, 2587000176, 258700 F13448, F13452, F13469, F13477, F13484, F13487, F13504, F13511, F13517, F13541, F13554, F13556, F13560, F13589, F13596, F13599, F13602, F13625, F5179 r 19446, r 19492, r 19493, r 1947, r 19494, r 19497, r 19394, r 1939, r 19394, r 19394, r 19390, r 19396, r 19398, r 19395, r 193 2640000201, 2640000204, 2640000205, 2640000208, 2640000212, 2640000218, 2640000221, 2640000224, 2640000229, 2640000261, 2640000262, 2640000292 20-1000/201, 20-1000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-10000/2014, 20-100000/2014, 20-1096000171, 1096000187, 1096000194, 1096000199, 109600020, 1096000200, 1096000211, 1096000213, 1096000217, 1096000223, 1096000228, 1096000244 096000269 1096000270 1096000274 1096000286 109600029 1096000297 1096000304 1096000314 1096000322 1096000331 1096000336 10960008 09600082, F13823, F13828, F13835, F13980, F14116, F14139, F14152, F14166, F14168, F14169, F14180, F14188, F14189, F14196, F14197, F14199, F1420 F14203, F14204, F7062, F7119, F7163, F7179, F9390. K.K.NAGAR-AHMEDABAD: 209700001, 209700026, 209700042, 209700048, 209700052, 209700162, F5544 -5550, F7435, F7585, F7607, F7624, F7625, F7629, F7651, F7660, F7661, F7674, F7675, F7677, F7679, F7680, F7681, F7682, F7685, F7699, F7691, F7695 7696, F7702. MANINAGAR: 1255000059, 1255000066, 1255000072, 1255000074, 1255000076, 1255000087, 1255000097, 12550000102, 125500 255000125, 1255000132, 1255000133, 1255000136, 1255000138, 125500018, F4243, F5725, F7348, F7351, F7352, F7362, F7371, F7374, F7387, F7388, F7390 -7391, F7392, F7393, F7396, F7397, F7398, F7399, **MOTERA;** 247700064, F6527, F6784, F6823, F7005, F7056, F7074, F7076, F7092, F7110, F7132, **NARANPUR** F1391, F1392, F1393, F1393, F1393, F1393, F1393, MUTEKS: 241700064, F0527, F0548, F0523, F1005, F100 F11202, F11224, F11230, F11236, F8315, F9028, **NARODA**: 210400012, 210400024, 210400047, 210400066, 210400158, 210400159, 210400160, 210400163 4812, F5221, F5222, F7276, F7289, F7294, F7299, F7303, F7309, F7329, F7331, F7355, F7391, F7392, F7400, F7402. NIKOL: 2657000057, 2657000057 £657000061, 2657000068, 2657000086, 2657000087, 2657000089, 2657000101, 2657000113, 2657000115, 2657000124, 2657000126, 265700014, 265700015 2657000156, 2657000177, 2657000185, 2657000195, 2657000199, 2657000201, 265700021, 265700021, 265700022, 265700022, 2657000239, 265700025, 265700073 265700092, 265700114, 265700115, F10049, F10559, F10564, F10598, F10660, F10614, F10623, F10632, F10667, F10677, F10677, F7404, F9910. **ODHA**)
0974000003, 0974000010, 0974000014, 0974000015, 0974000020, 0974000027, 0974000032, 0974000040, 097400005, 0974000057, 0974000065, 097400006 097400009, 097400037, 097400042, 097400044, 097400060, 097400061, 097400065, F11424, F11713, F11836, F11852, F11878, F11896, F11954, F11960, F11962 F11985, F11986, F12019, F9005, F8667, F8673, F8690, F957. **PALDI**: 1192000030, 1192000040, 1192000048, 1192000067, 1192000072, 1192000080, 1192000080, 1192000086, 119200014, 119200015, F2488, F2536, F2537, F2538, F2542, F3277, F5323, F5330, F5337, F5341. **SANAND-AHMEDABAD**: 248800023, 248800068 248800072, 248800076, 248800088, 248800114, 248800117, 248800144, 248800163, 248800492, F10043, F12519, F12564, F12565, F12575, F12592, F12622 F12659, F12666, F12670, F12711, F12735, F12759, F12824, F12848, F12853, F12925, F6462. સંલગ્ન શાખાઓ પર હરાજી કરવામાં આવશે. કૃપા કરી ઘયાન રાખો કે કોઇ કારણોસર હરાજી તે જ દિવસે પૂર્ણન થાય તો, તેની પુનઃ હરાજી તારીખ 22.06.2024 ના રોજ સવારે 10 વાગ્યે આ સરના

કરવામાં આવશે Muthoot FinCorp Ltd., Ground Floor, Orange Mall, 28, 29, Ahmedabad Mehsana High Way, Near Sharda Petrol Pump, Chandkheda, Gujarat - 382424. *બોલી બોલનારીરો ફોટો આઇલી કાર્ડ, પાંન કાર્ડ સાથે લાવવા વિનંતી. સફળ બોલી બોલનારે RTGS મારફતે નાણાં ઢ્રન્સફર કરવા પડશે. Muthoot FinCorp Ltd



રીજનલ ઓફિસ, અમદાવાદ : ધી સાઉથ ઈન્ડિયન બેંક લિં, રીજનલ ઓફિસ, અમદાવાદ : ચોથો માળ, સાકાર - VII, નેહરૂ બ્રીજ જંકશન, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯ ફોન નં. ૦૭૯-૨૬૫૮૫૬૦૦,૫૭૦૦ ઈમેલ : ro1018@sib.co.in

Ref. No.: RO-AHM/LEG-SAR/AK/10/2024-2025 ઇ - હરાજી વેચાણ સૂચના

ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮(૬) અને હે(૧) ની જોગવાઈ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટિસ 3ેધારકર્તાઓ**.**

.૨મેશ બાબુલાલ ગોર પ્લોટ નં.૬૫, શેરી નં.૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ,ભાનુશાલી નગર, ભુજ, કચ્છ-૩૭૦૦૦૧

1.૧૧માં **માપ્યુપાલ માર આઇ** નેદ્રય, કરી ને તુ, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ભાનુશાળી નગર, ભુજ, કચ્છ 39૦૦૦૧ **3.શ્રી હર્ષદ બાબુલાલ ગોર,** પ્લોટ નંદ્રય, શેરી ને ૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ભાનુશાળી નગર, ભુજ, કચ્છ 39૦૦૦૧ **4.શ્રીમતી મનીષા હસમુખ ગોર,** પ્લોટ નંદ્રય, શેરી નં૧, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ 39૦૦૦૧ આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને ઉઘારકર્તા/ જમીનદાર ને નોટિસ આપવામાં આવે છે કે નીચે જણાવેલી સ્થાવર મિલકત સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ

શાખા ભુજ (સિક્યોર્ડ ક્રેડિટર)ને ગીરવે મૂકવામાં આવી છે. જેનો પ્રત્યક્ષ કબજો ધ સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ ના અધિક્રત અધિકારી (સિક્યોર્ડ ક્રેડિટર) દ્વાર લેવામાં આવ્યો છે. તે તા. **૨૫.૦૬.૨૦૨૪** ના રોજ તે **"જે જેમ છે ત્યાં છે" "જેમ છે તેમ" અને "જે ત્યાં છે તેમ" ના આધારે વેચવામાં આવશે. ધી સાઉથ ઇન્ડિયન બેંક લિં, ભુજ (સિક્યોર્ડ ક્રેડિટર) પાસેથી ભવિષ્યના વ્યાજ, ખર્ચ અને ખર્ચ વગેરે સાથે ૦૨.૦૬.૨૦૨૪ ના રોજ રૂ. ૩,૮૨,૪૮,૩૦૯.૩૩ (રૂપિયા ત્રણ કરોડ** <mark>બ્યાસી લાખ અંડતાલીસ હજાર ત્રણસો નવ અને તેત્રીસ પૈસા પુરા)</mark> ની રકમની વસૂલાત માટે.

સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (અધિનિયમ) ૨૦૦૨ તથા સિક્યોરિટ

| | • • |
|-------------------------------|--|
| મિલકત માલિકનું નામ - | શ્રી હર્ષદ બાબુલાલ ગોર |
| મિલકતનું વર્ણન | શ્રી હર્ષદ બાબુલાલ ગોર ની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની ઓફિસ નં. દ, પહેલો માળ, "પટેલ ટાવર્સ" નામ અને શૈલી હેઠળ બહુમાળી ઈમારત, બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૧૯૯.૯૨ સ્કે.મી. (આશરે) અને કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૧૯૧.૪૦ સ્કે.મી., જે સ્થિત મિલકતનો પ્લોટ નં. ૧ અને ૧૫, સંયુકત રેવન્યુ સર્વે નં. ૩૨/૧ પૈકી, મીરઝાપુર ગામ, ભુજ તાલુકો - કચ્છ જીલ્લો અને તેમાં કરવામાં આવેલ અન્ય તમામ સુવિધાઓ સાથે તા. ૧૪.૦૨.૨૦૦૭ ના રજીસ્ટર્ડ સેલ ડીડ નં. ૧૫૬૯/૨૦૦૭ માં વધુ સંપૂર્ણ રીતે વર્ણવેલ. યતુઃસીમા:- ઉત્તરે : રોડ, દક્ષિણે : કોમન જગ્યા, પૂર્વે : ઓફિસ નં. ૫, પશ્ચિમે ઃ રોડ |
| અનામત કિંમત | રૂ. ૧,૧૦,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ દસ લાખ પુરા) |
| અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) | રૂ. ૧૧,૦૦,૦૦૦/- (રૂપિયા અગિયાર લાખ પુરા) ઇએમડી ૨૪.૦૬.૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી જમા કરવામાં આવશે |
| બિડ વૃદ્ધિ રક્રમ | રૂ. ૧૦,૦૦૦/- (રૂપિયા દસ હજાર પુરા) |
| ઇ-હરાજીની તારીખ અને સમય | ૨૫.૦૬.૨૦૨૪ સુધી બપોરે ૦૩.૦૦ થી ૦૪.૦૦ વાગ્યા સુધી (વેચાણ પૂર્ણ થાય ત્યાં સુધી 5 મિનિટના અમર્યાદિત ઓટો એક્સ્ટેન્શન સાથે) |
| બેંકને જાણમાં બોજો | નથી |

ાચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે, કૃપા કરીને સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડના વેબ પોર્ટલ (સિક્યોર્ડ ક્રેડિટર) વેબસાઇટ એટલે 🤅 http://www.southindianbank.com પર પ્રદાન કરેલી લિંકનો સંદર્ભ લો. http://www.bankauctions.in/ પર પણ વિગતો ઉપલબ્ધ છે. મિલકતની ચકાસણી, ઈ-હરાજીના નિયમો અને શરતો અથવા બિડ રજૂ કરવાના સંબંધમાં વધુ કોઈ સ્પષ્ટતા માટે શ્રી અકિલ મણિયાર, રિકવરી ઓફિસર, ધ સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ - અમદાવાદ રિજનલ ઓફિસનો +91 9284647412 સંપર્ક કરો.

તારીખ: ૦૩.૦૬.૨૦૨૪

હ-ઋણલેનાર અને ગીરો આપનાર)

નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે)

અધિકત અધિકારી ધી સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ



ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. (અગાઉ ઇક્વિટાસ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)

કોર્પોરેટ ઓફિસ: નંબર 769, સ્પેન્સર પ્લાઝા, ચોથો માળ, ફેઝ-2, અના સલાઇ, ચેન્નાઈ - 600002. **શાખા ઓફિસ**: ૩૦૫-૩૦૬, ત્રીજો માળ, અભિશ્રી એદ્રોઇટ, સનરાઇઝ મોલ પાસે, માનસી સર્કલ, જજીસ બંગ્લોઝ રોડ, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત - 380015.

<u>કબજા નોટિસ</u>

આથી, ઇક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ, કંપની કાયદા, ૧૯૫૬ હેઠળ સંસ્થાપિત બેંકિંગ કંપની અને ધ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ હેઠળ બેંકિંગ વ્યવસાય કરતી જે તેની રીજસ્ટર્ડ ઓફીસ યોથો માળ, ફેઝ-ર, સ્પેન્સર પ્લાઝા, ૭૬૯, અન્ના સલાઈ, ચેન્નઈ, તમિલનાડુ , ૧૦૦૦૨ ખાતે, રીજનલ ઓફીસ ઇડિવટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, ૩૦૫-૩૦૬, ત્રીજો માળ, અભીશ્રી એડ્રોઈટ, સનરાઈઝ મોલ પાસે, માનસી સર્કલ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ ૩૮૦૦૧૫, ગુજરાત તેના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ અરજદાર/દેવાદાર/સહ-અરજદાર/સહ-દેવાદાર/જામીનદારો/ગીરવેદારોને માંગણાં નોટીસ જારી કરી નોટોસમાં જણાવેલ રકમ તેમજ કરાર(રો) મુજબ્ અનુગામી વ્યાજ, પેનલ વ્યાજ, ચાર્જિસ, કોસ્ટ, વગેરે એગ્રીમેન્ટ મુજબ આ નોટીસ મળ્યાની તારીખ થી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. અરજદાર/ઋણલેનાર/સહ-અરજદાર/સહ-ઋણલેનાર/ગેરંટર/મોટેગેજર્સ, ૨કમ પરત કરવામાં નિષ્ફળ ગયા હોવાને કારણે, ખાસ કરીને અરજદાર/ઋણલેનાર

તલ-ઋણલેનાર/ગેરેન્ટર/ગીરનાર/ ગીરવે મૂકનારાઓને અને સામાન્ય જનતાને નોટિસ આપવામાં આવે છે, જે **એડિશનલ યીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કઠોર**, સુરત ના આદેશ અનુસાર, ૦૩.૦૪.૨૦૨૪ - સિરિયલ નંબર ૧ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ઓલપાડ, સુરત નો આદેશ, એમદાવાદ , તા. ૦૨.૦૪.૨૦૨૪ - <mark>સીરીયલ નંબર ૨</mark> ના રોજ પસાર કરવામાં આવેલ હુકમ મુજબ, કોર્ટ કમિશનર મારફતે નીચે સહી કરેલ અધિકૃત અધિકારીએ સેક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વાંચવામાં આવેલા ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૪) હેઠળ તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતનો કબજો લીધો છે.

અરજદાર/ઋણલેનાર/સંહ-અરજદાર/સહ-ઋણલેનાર/ગેરેન્ટર્સ/મોર્ટગેજર્સ ખાસ કરીને અને સામાન્ય જનતાને આ દ્વારા મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકતસાથેનો કોઈ પણ વ્યવહાર ઇક્વિટીઝ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ ના ચાર્જને આધિન રહેશે. અરજદાર / ઋણલેનાર/ સહે અરજદાર / સહ-ઋણલેનાર / ગેરંટર / મોર્ટગેજર્સ નું ધ્યાન સુરક્ષિત સંપત્તિઓના રિડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં, ઉક્ત કાયદાની કલમ 13 ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પર આમંત્રિત કરવામાં આવે છે.

| ક ન | ઋણલેનાર(ઓ) / ગેરેન્ટર(ઓ) નું નામ | સિક્યોર્ડ એસેટનું વર્ણન (સ્થાવર મિલકત) | ડિમાન્ડ નોટિસ તારીખ અને અમાઉન્ટ | કબજાની તારીખ |
|--------|--|--|---|-----------------|
| 1 | લોન/સુવિધા ખાતા નં. 700005238160/ EMFSURTA0036237 & 700005238671/ ELPSURTA0036238 (૧) શ્રી રાજારામ ફેક્રુ રાજભર જે શ્રી ફેક્ર્ રાજભર ના પુત્ર (અરજદાર/ઋણલેનાર અને ગીરવે મૂકનાર) (૨) શ્રીમતી મમતા દેવી જે શ્રી રાજારામ રાજભર ની પત્ની(સહ-અરજદાર/સહ- ઋણલેનાર અને ગીરો રાખનાર) (૩) શ્રી જોગીન્દર રે જે શ્રી શિવનાથ ના પુત્ર (ગેરેન્ટર) | શ્રી રાજારામ કેકુ રાજભર જે શ્રી ફેકુ રાજભર અને શ્રીમતી મમતા દેવી જે રાજારામ રાજભર ની પત્ની ની માલિકીની સ્ટેણાંક મિલકત. તમામ ભાગ અને હિસ્સા સાથે ની જમીન અને બિલ્ડીંગ નો પ્લોટ નંઝ ડ બ્લોક નં 3 /ડેગ્ડ તરીકે ઓળખાતી કેજેપી મુજબ), જેનું ક્ષેત્રફળ ૬૦.૩૪ સ્કવેર મીટર સાઇટ માટે, જેમાં રોડ અને સીઓપીમાં ૩૮.૯૫ સ્કવેર મીટર જેટલો અવિભાજિત પ્રમાણસર હિસ્સો, બ્લોક નં ૩ (રેવન્યુ સર્વે નં ૨) ધરાવતી જમીન પર આવેલી "શિવાલય રેસિડેન્સી", ૮૬.૧૦૦ સ્કવેર મીટર, ગામ- ટુંડી, પેટા જિલ્લા-પલસાણા, જિલ્લા-સુરત. ચતુઃ સીમા - ઉત્તર : પ્લોટ નં.૪૨, દક્ષિણ : પ્લોટ નં.૪૪, પૂર્વ : પ્લોટ નં.૪૪, પશ્ચિમ : સોસાયટી રોડ | રૂ. ૧૦,૮૦,૫૩૧/- (રૂપિયા દસ લાખ એંસી હજાર પાંચસો એકત્રીસ પુરા) ૨૧.૧૧.૨૦૨૩ | ર૯.૦૫.૨૦૨૪ |
| 2 | લોન/સુવિધા ખાતા નં. 700006051774/ EMFSURTA0043905 & 700006057816/ ELPSURTA0043908 (૧) શ્રી રજનીશકુમાર ચાદવ જે શ્રી ચંદ્રમા ચાદવ ના પુત્ર (અરજદાર/ઋણલેનાર અને ગીરો મુકનાર) (૨) શ્રીમતી યાદવ સોની કુમારી જે શ્રી રજનીશ યાદવ ની પત્ની (સહ-અરજદાર/ | શ્રી રજનીશકુમાર યાદવ જે ચંદ્રમા ના પુત્ર અને શ્રીમતી યાદવ સોની કુમારી જે રજનીશ યાદવ ની પત્ની ની માલિકીની રહેણાંક મિલકત. તમામ ભાગ અને હિસ્સા સાથે ની જમીન અને બિલ્ડીંગ નો પ્લોટ નં. ૯૭, આશરે ૪૨.૪૩ ચોરસ મીટર જમીન, રોડ અને સીઓપીમાં અવિભાજિત પ્રમાણસર હિસ્સાની સાથે આશરે ૩૦.૫૨ ચોરસ મીટર જેટલું અંતર, કુલ ૭૨.૯૫ ચોરસ મીટર, બ્લોક નં.૧૫૦ (રેવ-ચુ સર્વે નં.૩૦૬) ધરાવતી જમીન ઉપર આવેલી "વ્રજ રેસિડેન્સી" હેક્ટર- ૧-૨૬-૪૭ ચોરસ મીટર, ગામ-સિયાદલા, ઉપ જિલ્લા-ઓલપાડ, જિલ્લા-સુરત. ચતુઃ સીમા - ઉત્તર : અડીને આવેલા પ્લોટ નં.૯૬. દક્ષિણ : અડીને આવેલા પ્લોટ નં.૯૮. પર્વ : | ર. ૧૦,૪૨,૩૪૧/- (રૂપિયા દસ લાખ બેતાલીસ હજાર ત્રણસો એકતાલીસ પુરા) ૨૧.૧૧.૨૦૨૩ મુજબ બાકી રકમ તેમજ | ર૯.૦૫.૨૦૨૪ |

અડીને આવેલા પ્લોટ નં.૫૦, પશ્ચિમ : સોસાયટીનો આંતરિક માર્ગ —— અધિકૃત અધિકારી ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ. તારીખ - ૦૪.૦૬.૨૦૨૪ સ્થળ - ગુજરાત

આવેલા પ્લોટ ન.૯૬, દક્ષિણ : અડીને આવેલા પ્લોટ ન.૯૮, પૂર્વ : ૨૨.૧૧.૨૦૨૩ થી